

દાખલ તારીખ : ૧૮/૦૭/૨૦૨૫
 નોંધ્યા તારીખ : ૧૮/૦૭/૨૦૨૫
 ફેસલ તારીખ : ૧૨/૦૬/૨૦૨૬
 સમયગાળો : વર્ષ માસ દિન
 ૦૦ ૧૦ ૨૪

ગોંડલના મહે. પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબશ્રીની કોર્ટ સમક્ષ,
 મું. ગોંડલ.

કોમર્શીયલ સિવિલ સ્યુટ નં.૨૪/૨૦૨૫
 આંક: ૨૩

વાદી : M/s EPP Composites Private Limited
 Through its authorized Person
 Mr. CHIRAG JITENDRABHAI KESARIA,
 Address. M/s EPP Composites Private Limited,
 GIDC Lodhika Industrial Estate, Plot No.2646&2647,
 Kranti Gate, Main Road, Kalawad Road, Metoda
 G.I.D.C, Ta.Lodhika, Dist.Rajkot-360021

વિરુદ્ધ

પ્રતિવાદી: (1) M/s SAI SANKET ENTERPRISES
 (2) MR.MILIND SAKHARAM MURUDKAR
 Address. M/S SAI SANKET ENTERPRISES
 1st FLOOR, MAHADEV PARA, MANOJ KUMAR
 CHOUDHURY, MAHADEV PARA, CENTER POINT,
 SUNDARGARH, ODISHA-770001, Mo.97735 78343.

બાબત: લેણી રકમ રૂ.૧૫,૯૬,૮૯૦/- વસુલ મળવા અંગે...

વાદી તરફે : વિ. વ. શ્રી એ. સી. ફળદુ.
 પ્રતિવાદી તરફે: એક તરફી

-:: ચુકાદો ::-

(૧) વાદીની હાલની દાવા અરજીની ટુંકમાં હકિકત એવી છે કે, વાદી કંપની
 ઇ. પી. પી. કમ્પોઝીટ પ્રા. લી. ના નામથી છેલ્લા ૩૦ વર્ષથી મેટોડા જી. આઈ.
 ડી. સી, તાલુકો, લોધીકા, જી.રાજકોટ મુકામે પોતાનો ધંધો કરે છે. પ્રતિવાદી

નં.૧ મે. સાંઈ સંકેત એન્ટરપ્રાઇઝના નામની પ્રોપરાઈટરશીપ ફર્મ છે અને પ્રતિવાદી નં.૨ સદરહું કંપનીના પ્રોપરાઈટર છે અને ફર્મનો ધંધાકીય વ્યવહાર સંભાળે છે અને તેથી ફર્મ દ્વારા કરવામાં આવેલ કોઈ પણ કામના જવાબદાર વ્યક્તિ પ્રતિવાદી નં.૨ છે. વાદીએ પ્રતિવાદી સાથે ઘણા સમયથી ધંધાકીય વ્યવહાર રાખેલ છે અને જે અનુસંધાને પ્રતિવાદીએ વાદી કંપની પાસેથી પર્ચેસ ઓર્ડર દ્વારા કંપોઝીટ પ્રોડક્ટસની ખરીદી કરેલ છે જેથી ટર્મ્સ એન્ડ કંડીશન મુજબ તથા પર્ચેસ ઓર્ડર મુજબ વાદી કંપનીએ પ્રતિવાદી ફર્મને તેની જરૂરીયાત મુજબ માલની ડીલીવરી કરી આપેલ છે. પર્ચેસ ઓર્ડરની શરતો મુજબ પ્રતિવાદીને ૩૦ દિવસનો ક્રેડીટ પીરીયડ મળેલ છે અને વધારામાં નક્કિ થયેલ શરતો મુજબ ઓવરડ્યુ પેમેન્ટ થાય તો, પ્રતિવાદીએ તેના પર ૧૮% વ્યાજ ચુકવવાનું રહેશે.

(૧.૧) નીચે મુજબના ઇનવોઇસ મુજબની તારીખે તેમા જણાવ્યા મુજબની રકમનો માલ વાદી કંપની દ્વારા પ્રતિવાદી ફર્મને મોકલવામાં આવેલ છે.

Sr No.	INVOICE NO.	INVOICE DATE	AMOUNT
1.	1990400075	22/04/2019	Rs.11,68,278/-
2.	1990400280	10/06/2019	Rs.11,82,186/-
3.	1990400324	22/06/2019	Rs.3,47,701/-

ઉપરોક્ત ઇનવોઇસ મુજબ પ્રતિવાદીઓ વાદીને રૂ.૨૬,૯૮,૧૬૭/- ચુકવવા જવાબદાર છે. પરંતુ પ્રતિવાદીએ માત્ર રૂ.૧૧,૦૧,૨૭૭/- વાદીને ચુકવેલ છે. જેથી હજુ પણ વાદીના રૂ.૧૫,૯૬,૮૯૦/- પ્રતિવાદી પાસેથી લેણાં નીકળે છે. જે ચુકવવા પ્રતિવાદી જવાબદાર બને છે.

(૧.૨) પર્ચેસ ઓર્ડર મુજબ વાદીએ પ્રતિવાદીને તેની જરૂરીયાત મુજબના તથા જણાવેલ સરનામે ઓરીજનલ ઇનવોઇસ સાથે ટ્રાન્સપોટેશન દ્વારા પુરતો માલ મોકલી દીધેલ છે. ત્યારબાદ વાદીએ વારંવાર બાકી રહેતી રકમ ચુકવવા પ્રતિવાદીને લેખીત તથા મૌખિક ઇ-મેઇલ દ્વારા તથા ટેલીફોન દ્વારા જાણ કરેલ છે. પરંતુ પ્રતિવાદીએ બાકી લેણી રકમ ચુકવેલ નથી.

ત્યારબાદ વાદીએ પ્રતિવાદીને તા.૨૧/૧૧/૨૦૨૪ ના રોજ તેમના વકીલ મારફત આર. પી. એડી મારફત નોટીસ મોકલેલ છે અને સદરહું બાકી રહેતી લેણી રકમ ચુકવી આપવા જણાવેલ છે. લીગલ નોટીસ બજી જવા છતાં પ્રતિવાદીએ બાકી રહેતી લેણી રકમ વાદીને ચુકવવા કોઈ દરકાર કરેલ નથી જેથી વાદીએ હાલનો દાવો રૂ.૧૫,૯૬,૮૯૦/- ૧૮% ના વ્યાજ સાથે ઇનવોઈસની તારીખથી પ્રતિવાદી પાસેથી મેળવવા દાખલ કરેલ છે.

(૦૨) પ્રતિવાદીઓને દાવાનો સમન્સ કરતા જે બજી જતાં પ્રતિવાદીઓ જાતે કે તેમના વિ. વકિલશ્રી મારફતે હાજર થયેલા નથી તેથી પ્રતિવાદીઓ સામે દાવાની કાર્યવાહી એકતરફી ચલાવવાનો માટેનો તા.૦૭/૦૩/૨૦૨૬ ના રોજ આંક-૦૧ નીચે હુકમ કરવામાં આવેલ છે.

(૦૩) વાદી તરફે હાલનો દાવો પુરવાર કરવા નીચે મુજબના મૌખિક તથા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલા છે.

// મૌખિક પુરાવો //

ક્રમ નં.	નામ	આંક
૧.	વાદી ચીરાગ જીતેન્દ્રભાઈ કેસરીયાનું સરતપાસનું સોગંદનામું	૧૦

// દસ્તાવેજી પુરાવો //

ક્રમ	વિગત	આંક
૧	ઓથોરીટી લેટર	૧૧
૨	ઇનવોઈસ બીલ નં.	૧૨
૩	ઇનવોઈસ બીલ નં.૧૯૯૦૪૦૦૦૭૫	૧૩
૪	ઇનવોઈસ બીલ નં.૧૯૯૦૪૨૨૨૮૦	૧૪
૫	ઇનવોઈસ બીલ નં.૧૯૯૦૪૦૦૩૨૪	૧૫
૬	એકાઉન્ટ સ્ટેટમેન્ટ	૧૬
૭	એવીડન્સ એક્ટની કલમ-૬૫(બી)બી. એન. એસ. એ.) ની કલમ-૬૩ મુજબનું સર્ટીફિકેટ	૨૧

૮.	કલોર્જીંગ પુરશીશ.	૨૨
----	-------------------	----

(૦૪) વાદી તરફે વિ. વકિલશ્રી દ્વારા મૌખિક દલીલ કરવામાં આવેલ છે. જેમા જણાવેલ છે કે, વાદી રજુ પુરાવાઓથી દાવાની હકિકત પુરવાર કરવામાં સફળ રહેલ છે. તેમજ પ્રતિવાદીએ હાજર થઈ વાદીના દાવાને લેશમાત્ર પડકારેલ નથી તેથી વાદીનો દાવો મંજૂર કરવો જોઈએ.

(૦૫) સદર કામે દાવાના ન્યાયીક નિર્ણય માટે આંક-૦૬ થી નીચે મુજબના મુદ્દા કાઢવામાં આવેલા છે.

// મુદ્દાઓ //

- ૧) શું વાદી સાબીત કરે છે કે, આ દાવો દાખલ કરવા તે હકકદાર છે?
- ૨) શું વાદી સાબીત કરે છે કે, આ કામના પ્રતિવાદી સાથે કોર્મશીયલ વ્યવહારથી બાકી લેણી રકમ રૂ.૧૫,૮૬, ૮૮૦/- તે મેળવવા હકકદાર છે?
- ૩) શું વાદી સાબીત કરે છે કે, તે બાકી લેણી રકમ ઉપર વ્યાજ મેળવવા હકકદાર છે? જો હા તો કેટલું?
- ૪) શું વાદી સાબીત કરે છે કે, વાદી દાવામાં માંગ્યા મુજબની દાદ મેળવવા હકકદાર છે?
- ૫) શું હુકમ અને હુકમનામું.

(૦૬) ઉપરોક્ત મુદ્દાઓ અંગેના નિર્ણયો નીચે મુજબ છે.

- ૧) હકારમાં
- ૨) હકારમાં
- ૩) અંશત:હકારમાં
- ૪) અંશત:હકારમાં
- ૫) આખરી હુકમ મુજબ.

// કારણો //

મુદ્દા નં. ૧ ની ચર્ચા:-

(૦૭) વાદી તરફે ચીરાગ જીતેન્દ્રભાઈ કેસરીયાએ આંક-૧૦ થી સરતપાસનું સોગંદનામું રજુ રાખેલ છે. જેમાં દાવાની હકિકતોને સંપૂર્ણ સમર્થનકારી હકિકતો જણાવેલ છે. તેમજ પ્રતિવાદી સામે કામ એકતરફી ચલાવવાનો હુકમ થયેલ હોય વાદીની ઉલટતપાસ થયેલ નથી. આમ, પ્રતિવાદી દ્વારા હાજર રહી વાદીના પુરાવાને લેશમાત્ર પડકારવામાં આવેલ નથી. તેમજ મુદ્દા નં.૧ જોવામાં આવે તો, તે હાલના વાદીને દાવો દાખલ કરવાની સત્તા છે કે કેમ? તે બાબતેનો કાઢવામાં આવેલ છે. સદર મુદ્દા સંદર્ભે રજુ પુરાવાઓ જોવામાં આવે તો, વાદીએ હાલનો આ દાવો ઇપીપી કોમ્પોસીટ પ્રા. લી. ના દરજજે દાખલ કરેલ છે. તેમજ વાદી તરફે આંક-૧૨ થી તેમની કંપીનના બોર્ડ ઓફ ડીરેક્ટરોએ હાલના વાદી ચીરાગ જીતેન્દ્રભાઈ કેસરીયાને દાવો દાખલ કરવા ઓથોરીટી લેટર આપેલ છે. જે ઓથોરીટી લેટર રજુ રાખવામાં આવેલ છે. જે વંચાણે લેવામાં આવે તો, ઇપીપી કોમ્પોસીટ પ્રા. લી. ના બોર્ડ ઓફ ડીરેક્ટરોએ હાલના વાદીને દાવો દાખલ કરવા ઓથોરીટી આપેલ હોવાનું સ્પષ્ટ થાય છે. તેમજ પ્રતિવાદી દ્વારા સદર ઓથોરીટી લેટરને પડકારવામાં આવેલ ન હોય તે ન માનવાને કોઈ કારણ રહેતું નથી. આમ, વાદી કંપની ઇપીપી કોમ્પોસીટ પ્રા. લીના અધિકૃત વ્યક્તિ તરીકે વાદીએ હાલનો દાવો દાખલ કરેલ હોય વાદીને હાલનો દાવો દાખલ કરવા માટે સત્તા રહેલ હોવાનું પુરવાર થતું હોય મુદ્દા નં.-૧ નો જવાબ "હકારમાં" આપવામાં આવે છે.

મુદ્દા નં. ૨ ની ચર્ચા:-

(૦૮) આ કામના પ્રતિવાદી સાથે થયેલ કોમર્શીયલ વ્યવહારથી બાકી લેણી રકમ રૂ.૧૫,૮૬,૮૮૦/- પુરા મેળવવા હકકદાર છે કે કેમ? તે સંદર્ભે મુદ્દા નં.૨ કાઢવામાં આવેલ છે. મુદ્દા નં.૨ સંદર્ભે રજુ પુરાવો જોવામાં આવે તો, પ્રતિવાદી દ્વારા હાજર રહી વાદીના દાવાને કે પુરાવાને લેશમાત્ર પડકારવામાં આવેલ નથી. આમ, વાદીનો પુરાવો બિનપડકારાયેલ છે. તેમજ વાદી તરફે રજુ પુરાવાનું મુલ્યાંકન કરતા પહેલા હાલનો આ વ્યવહાર કોર્મશીયલ

વ્યવહાર છે કે કેમ? તે નકિક કરવાનું રહેશે. ધી કોમર્શિયલ કોર્ટ એક્ટ-૨૦૧૫ ની કલમ-૨(સી) માં કોમર્શિયલ ડીસ્પ્યુટની વ્યાખ્યા આપવામાં આવેલ છે જે મુજબ વેપારીઓ વચ્ચે થયેલ માલના ટ્રાન્ઝેક્શન બાબતેના વ્યવહારથી ઉભો થયેલ ડીસ્પ્યુટ કોમર્શિયલ ડીસ્પ્યુટ ગણાય. આ કામે વાદી પ્રાઇવેટ લીમિટેડ કંપની છે જેમના દ્વારા પ્રતિવાદી કે જે પ્રોપરાઇટર ફર્મ છે તેને માલ આપવામાં આવેલ છે. આમ, હાલનો આ વ્યવહાર કોમર્શિયલ વ્યવહાર છે તેવું સ્પષ્ટ થાય છે. તેમજ વાદીએ તેમની દાવા અરજીમાં જણાવેલ છે કે, તેમની કંપની દ્વારા પ્રતિવાદીને અલગ અલગ ત્રણ ઈન્વોઇસથી કુલ રૂ.૨૬,૯૮,૧૬૭/- નો માલ તા.૨૨/૦૪/૨૦૧૯ થી તા.૨૨/૦૬/૨૦૧૯ દરમિયાન વેચાણ કરવામાં આવેલ છે. જેમાંથી પ્રતિવાદીએ વાદીને રૂ.૧૧,૦૧,૨૭૭/- પુરા ચુકવી આપેલ છે. તેમજ વાદી તરફે આંક-૧૬ થી તા.૨૨/૦૪/૨૦૧૯ થી તા.૧૬/૦૩/૨૦૨૪ સુધીનો પ્રતિવાદીના ખાતાનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ રજુ રાખવામાં આવેલ છે. જે વંચાણે લેવામાં આવે તો, કલોર્ગીંગ બેલેન્સ રૂ.૧૫,૯૬,૮૯૦/- છે. તેમજ આંક-૧૬ થી રજુ એકાઉન્ટ સ્ટેટમેન્ટ વંચાણે લેવામાં આવે તો, પ્રતિવાદીએ તા.૩૧/૦૩/૨૦૨૦ ના રોજ રૂ.૮૯,૨૮૪/-, તા.૧૪/૧૨/૨૦૨૧ ના રોજ રૂ.૨,૧૧,૯૯૩/-, તા.૧૯/૧૦/૨૦૨૩ ના રોજ રૂ.૪,૦૦,૦૦૦/- તથા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ રૂ.૪,૦૦,૦૦૦/- એમ કુલ રૂ.૧૧,૦૧,૨૭૭/- વાદી કંપનીને ચુકવી આપેલ છે. ત્યારબાદ પ્રતિવાદીએ વાદીને કોઈ રકમ ચુકવેલ હોય તેવું આંક-૧૬ વાળા એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોતા જણાય આવતું નથી. તેમજ પ્રતિવાદીના ખાતાનો ઉતારો તથા બીલો કોમ્પ્યુટરાઈઝ ઉતારો હોય તે બાબતે વાદી તરફે ભારતીય સાક્ષ્ય અધિનીયમની કલમ-૬૩ મુજબનું સર્ટીફિકેટ આંક-૨૧ થી રજુ રાખવામાં આવેલ છે. તેમજ આંક-૧૬ થી રજુ પ્રતિવાદીના ખાતાનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોવામાં આવે તો, પ્રતિવાદી દ્વારા વાદી કંપનીમાંથી જે માલ લેવામાં આવતો હતો તે પેટે સમયાંતરે રકમ ચુકવવામાં આવતી હતી અને છેલ્લે તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ રૂ.૪,૦૦,૦૦૦/- ચુકવવામાં આવેલ છે. આમ, વાદીએ ૩ વર્ષની મુદતમાં હાલનો આ દાવો કરવો જોઈએ. વાદીએ

હાલનો આ દાવો દાખલ કરતા પહેલા કોર્મશીયલ એક્ટની કલમ-૧૨(અ) મુજબ મીડીયેશનમાં મુકવા માટે તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ અરજી આપેલ છે. તેમજ મીડીયેશન ન થતા તા.૦૨/૦૭/૨૦૨૫ ના રોજ તે અંગેનો રીપોર્ટ આપેલ છે. તેમજ ધી કોર્મશીયલ કોર્ટસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૧૨(અ) ની પેટા કલમ-૩ ના પરંતુક મુજબ મીડીયેશનનો સમય ધી લીમીટેશન એક્ટ-૧૯૬૩ માં આપેલ સમયમર્યાદામાં ગણવાનો રહેતો નથી. તેમજ ધી લીમીટેશન એક્ટની કલમ-૧૯ મુજબ સમયમર્યાદા પુરી થાય તે પહેલા પાર્ટ પેમેન્ટ કરવામાં આવે તો, તે દિવસથી લીમીટેશન ફરીથી શરૂ થાય. આ કામે પ્રતિવાદી દ્વારા લીમીટેશન પુરૂ થાય તે પહેલા પાર્ટ પેમેન્ટ કરવામાં આવેલ છે. આમ, વાદીનો હાલનો આ દાવો સમયમર્યાદામાં છે તેવું સ્પષ્ટ થાય છે. આમ, આ તમામ દસ્તાવેજો વંચાણે લેતા પ્રતિવાદી પાસેથી વાદીની બાકી રકમ રૂ.૧૫,૯૬,૮૯૦/- પુરા લેણાં નીકળે છે તેવું સ્પષ્ટ થાય છે. આમ, વાદી તરફે રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને પ્રતિવાદી તરફે હાજર રહી લેશમાત્ર પડકારવામાં આવેલ નથી. આમ, વાદી તરફે રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા ન માનવાને કોઈ કારણ રહેતું નથી. આમ, વાદી તરફે રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા જોતા પ્રતિવાદીએ વાદી કંપનીમાંથી તા.૨૨/૦૪/ ૨૦૧૯ થી તા.૨૨/૦૬/૨૦૧૯ ના સમય દરમિયાન ઉધાર માલ ખરીદ કરેલ છે તેની બાકી નીકળતી રકમ રૂ.૧૫,૯૬,૮૯૦/- પુરા નિકળે છે જે દાવો દાખલ કર્યા તારીખે વાદીની પ્રતિવાદી પાસેથી લેવાની બાકી નીકળતી હોવાનું પુરવાર થાય છે. આમ, વાદી પ્રતિવાદી પાસેથી રૂ.૧૫,૯૬,૮૯૦/- મેળવવા હકકદાર હોવાનું સ્પષ્ટ થાય છે. આમ, વાદી મુદ્દા નં.૨ પુરવાર કરવામાં સફળ રહેલ હોય મુદ્દા નં.૨ નો જવાબ "હકારમાં" આપવામાં આવે છે.

મુદ્દા નં. ૩ ની ચર્ચા:-

(૦૯) મુદ્દા નં. ૩ જોવામાં આવે તો, વાદી બાકી લેણી રકમ ઉપર વ્યાજ મેળવવા હકકદાર છે? જો હા તો કેટલું? તે મુજબનો કાઢવામાં આવેલ છે. વાદીએ બાકી લેણી રકમ ઉપર ૧૮% લેખે વ્યાજની માંગણી કરેલ છે. વાદી

તથા પ્રતિવાદી વચ્ચે વ્યાજ બાબતે કોઈ કરાર થયેલ હોય તેવો કોઈ પુરાવો વાદી દ્વારા રજૂ કરવામાં આવેલ નથી. પરંતુ આંક-૧૩ થી ૧૫ વાળા ઇનવોઈસમાં લેણી રકમનું પેમેન્ટ ઇનવોઈસ મળ્યાના ૩૦ દિવસમાં કરવામાં ન આવે તો ૧૮% વ્યાજ વસુલ કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પરંતુ વાદી દ્વારા માંગવામાં આવેલ ૧૮% વ્યાજ વધારે પડતુ જણાય આવે છે તેવા સંજોગોમાં સી. પી. સી કલમ-૩૪ ની જોગવાઈ ધ્યાને લેતાં, તેમજ પ્રવર્તમાન બેંકના વ્યાજ દરો તથા એફ. ડી. પરના વ્યાજ દરો વિગેરે ધ્યાને લેતાં, વાદીને લેણી રકમ ઉપર દાવો દાખલ કર્યા તારીખથી લેણી રકમ વસુલ આવતા સુધી ૯% વાર્ષિક વ્યાજ અપાવવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાઈ રહેશે તેવુ જણાય આવે છે. જેથી વાદી પ્રતિવાદી પાસેથી લેણી રકમ ઉપર વાર્ષિક ૯% વ્યાજ મેળવવા હકકદાર હોવાનું પુરવાર થાય છે. આમ, વાદી મુદ્દા નં. ૩ ની હકિકત પુરવાર કરવામાં અંશતઃસફળ રહેલ હોય મુદ્દા નં. ૩ નો જવાબ "અંશતઃહકારમાં" આપવામાં આવે છે.

મુદ્દા નં.૪ ની ચર્ચા:-

(૧૦) મુદ્દા નં.૪ જોવામાં આવે તો, વાદી માંગ્યા મુજબની દાદ મેળવવા હકકદાર છે કે કેમ? તે મુજબનો કાઢવામા આવેલ છે. સદર મુદ્દા સંદર્ભે જોવામાં આવે તો, વાદી આ કામના પ્રતિવાદી પાસેથી દાવો દાખલ કર્યા તારીખે બાકી નિકળતી લેણી રકમ રૂ.૧૫,૯૬,૮૯૦/- પુરા બાકી નીકળતી હોવાનું પુરવાર કરવામાં સફળ રહેલ હોય વાદી લેણી રકમ રૂ.૧૫,૦૯,૮૯૦/- પુરા ઉપર દાવો દાખલ કર્યા તારીખથી સદર લેણી રકમ વસુલ આવતા સુધી તેની ઉપર વાર્ષિક ૯% લેખે સાદુ વ્યાજ મેળવવા હકકદાર હોવાનું પુરવાર થાય છે. આમ, વાદી મુદ્દા નં.૪ પુરવાર કરવામાં અંશતઃસફળ રહેલ હોય મુદ્દા નં.૪ નો જવાબ "અંશતઃહકારમાં" આપવામાં આવે છે અને મુદ્દા નં. ૫ પરત્વે નીચે મુજબનો "આખરી હુકમ" કરવામાં આવે છે.

-:: આખરી હુકમ ::-

૧) વાદીનો હાલનો દાવો અંશતઃમંજૂર કરવામાં આવે છે.

૨) વાદી પ્રતિવાદી પાસેથી બાકી નિકળતી લેણી રકમ રૂા.૧૫,૯૬,૮૯૦/- (અંકે રૂપીયા પંદર લાખ છનું હજાર આઠસો નેવુ પુરા) દાવો દાખલ કર્યા તારીખથી સદર લેણી રકમ વસુલ આવતા સુધી તેની ઉપર વાર્ષિક ૯% ના સાદા વ્યાજ સાથે મેળવવા હકકદાર હોવાનું ઠરાવવામાં આવે છે.

૩) પ્રતિવાદીએ વાદીને થયેલ દાવાનો ખર્ચ ચુકવવો તથા પોતે પોતાનો ખર્ચ ભોગવવો.

૪) ઉપરોક્ત હુકમ મુજબ હુકમનામું દોરવું.

હુકમ આજરોજ તારીખ:૧૨ મી, માહે:જુન, સને:૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

તારીખ:૧૨/૦૬/૨૦૨૬
સ્થળ: ગોંડલ.

(કુ. જિજ્ઞાશા માણેકલાલ ગજ્જર)
પ્રિન્સીપાલ સીનીયલ સીવીલ જજ,
ગોંડલ.
(GJ00921)